

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન આરોગ્ય સંભાળ માટે પ્રોવિન્સ પાસેથી વ્યાજબી ભંડોળની માગ કરે છે

રહેવાસીઓ દરખાસ્ત (પિટિશન) પર સહી કરીને, પોતાની આરોગ્ય સંભાળ સંબંધિત વાત જાહેર કરીને અને આ વર્ષના ઉત્તરાર્ધમાં અમારી સાથે ક્વીન્સ પાર્કમાં જોડાઈને કાર્ય કરી શકે છે.

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 18, 2019) – બ્રેમ્પટનમાં આરોગ્ય સંભાળ માટે બહુ લાંબા સમયથી જરૂર કરતા ઓછું ભંડોળ મળે છે.

બ્રેમ્પટનની હોસ્પિટલોમાં વધારે પડતી ભીડ અને હોસ્પિટલની પરસાળમાં દર્દીઓની સારવાર સામાન્ય રીતે જોવામાં આવે છે. હવે, સીટી ઓફ બ્રેમ્પટન આપણાં શહેરમાં આરોગ્ય સંભાળ માટે ઓન્ટેરિયો પ્રોવિન્સ પાસેથી તાત્કાલિક ભંડોળ માગી રહ્યું છે.

અમે શનિવાર, જૂન 15 નાં રોજ બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટ ખુલવાના દિવસે #FairDealForBrampton આરોગ્ય સંભાળ ઝુંબેશ ઔપચારિક રીતે શરૂ કરી, અને તેમાં સંખ્યાબંધ રીતે સામેલ થઈ શકાય છે.

સાચી સમસ્યા

બ્રેમ્પટનના રહેવાસીઓ આપણાં સમુદાયમાં આરોગ્ય સંભાળ માટે જરૂરિયાત કરતા ઓછું ભંડોળ મળવાનો પ્રભાવ અનુભવી રહ્યાં છે.

- બ્રેમ્પટન વ્યક્તિ દીઠ, આરોગ્ય સંભાળ ભંડોળમાં પ્રોવિન્સની સરેરાશ કરતા **\$1,000** ઓછું ભંડોળ મેળવે છે
- બ્રેમ્પટનમાં અન્ય ઓન્ટેરિયો શહેરો કરતા **55 ટકા ઓછી હોસ્પિટલ બેડ્સ ઉપલબ્ધ છે**
- બ્રેમ્પટન વસ્તીમાં ઝડપી વૃદ્ધિનો સામનો કરી રહ્યું છે – **14,000 લોકો બ્રેમ્પટનમાં દર વર્ષે સ્થળાંતર કરે છે**, અને આપણી વસ્તીને સહાયરૂપ બનવા આપણને વધારે આરોગ્ય સંભાળ સંસાધનોની જરૂર છે

જરૂરિયાત

બ્રેમ્પટનને આરોગ્ય સંભાળ માટે વ્યાજબી ભંડોળની જરૂર છે. અમે આપણાં શહેર માટે નીચેની જરૂરી આરોગ્ય સંભાળ સેવાઓ અને માળખાગત સગવડો પૂરી પાડવા પ્રોવિન્સને કહીએ છીએ.

- પીલ મેમોરિયલ હોસ્પિટલમાં આવેલા ઓર્થોપેડિક સેન્ટરમાં મુલાકાતીઓના વધતા જતા પ્રમાણને સહાયરૂપ થવા **તાત્કાલિક ભંડોળ પૂરું પાડવું**
- પીલ મેમોરિયલ હોસ્પિટલમાં ફેઝ 2 નું ભંડોળ પૂરું કરવું
- બ્રેમ્પટનમાં ત્રીજી આરોગ્ય સંભાળ સગવડ ઊભી કરવી

મંતવ્ય વ્યક્ત કરો

આપણે સાથે મળીને, પ્રોવિન્સને કાર્યવાહી કરવાની માગ કરી શકીએ છીએ. રહેવાસીઓ અહીં આ રીતે મંતવ્ય વ્યક્ત કરી શકે છે.

- **દરખાસ્ત (પિટિશન) પર સહી કરો.** દરખાસ્ત હવે બ્રેમ્પટન રિક્રિએશન સેન્ટર્સ, પુસ્તકાલયો અને સીટી હોલમાં ઉપલબ્ધ છે. તે દર શનિવારે બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટમાં, અને જુલાઈ 1 નાં રોજ કેનેડા દિવસ પર ચિંગકુસી પાર્કમાં પણ ઉપલબ્ધ થશે. [દરખાસ્ત સ્થળો જાણવા માટે અહીં ક્લિક કરો.](#)

- **ક્વીન્સ પાર્કમાં અવાજ ઉઠાવો.** આ વર્ષના ઉત્તરાર્ધમાં, બ્રેમ્પટન માટે પ્રોવિન્સ વ્યાજબી ભંડોળની આપણી જરૂરિયાત સમજે તેની ખાતરી કરવા અમારો હેતુ ક્વીન્સ પાર્કમાં બ્રેમ્પટનિયન્સનું વિશાળ સમૂહ લાવવાનો છે. [નોંધણી કરાવવા અહીં ક્લિક કરો.](#)
- **તમારી વાત જણાવો.** રહેવાસીઓ સોશિયલ મીડિયા પર #FairDealForBrampton હેશટેગ વાપરીને, આપણી [ટિવબન ઝુંબેશ](#) અનુસરીને પોતાની આરોગ્ય સંભાળ સંબંધિત વાત જાહેર કરી શકે છે, આપણાં [ફેસબુક ગ્રુપ](#)માં અન્ય લોકો સાથે પ્રવૃત્તમય થઈને અને અમને અહીં ઈમેલ પણ મોકલી શકે છે, FairDealForBrampton@brampton.ca.

સંપૂર્ણ વિગતો અહીં ઉપલબ્ધ છે, www.FairDealForBrampton.ca.

અવતરણ (ક્વોટ):

“બ્રેમ્પટનનું આરોગ્ય સંભાળ તંત્ર બહુ લાંબા સમયથી જરૂરિયાત કરતા ઓછું ભંડોળ મેળવી રહ્યું છે, અને આપણાં રહેવાસીઓ અને આરોગ્ય સંભાળ પૂરી પાડનારાઓ વધારે સારી સેવાઓ મેળવવાને લાયક છે. એક આરોગ્યપ્રદ અને સુરક્ષિત શહેર તરીકે, બ્રેમ્પટનને આપણાં વિકસતા સમુદાયને સહાયરૂપ બનવા વધારે ભંડોળ અને વિસ્તૃત સંસાધનોની જરૂર છે. અમે કાર્ય કરી રહ્યાં છીએ અને પ્રોવિન્સને વ્યાજબી ભંડોળ માટે કહેવામાં દરેક વ્યક્તિને સામેલ કરી રહ્યાં છીએ. અમારી દરખાસ્ત પર સહી કરવા અને #FairDealForBrampton નો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર તમારી વાત ચોક્કસપણે જણાવશો.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને ત્યાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca